

Government BBA College (Self-Finance)

Maninagar, Ahmedabad

Celebration of International Yoga Day on 21 June 2026

As part of the celebration of **International Yoga Day** on **21 June 2026**, the **12th International Yoga Day** was observed at **Government BBA College (Self-Financed), Maninagar, Ahmedabad**, with the theme "**Yoga for Healthy Ageing.**"


The event was enthusiastically attended by the college Principal, **Dr. Yogesh Yadav**, teaching and non-teaching staff members, and students. A total of **87 students** participated in the programme.

Dr. Viren Manek delivered an informative and engaging session on the importance and benefits of **Surya Namaskar (Sun Salutation)**. Thereafter, he guided the participants in performing **Surya Namaskar** and various **yoga asanas (postures)**.

The programme successfully promoted awareness about the significance of yoga in maintaining physical and mental well-being and encouraged participants to adopt a healthy and disciplined lifestyle.









Shri Narendra Modi
Hon'ble Prime Minister



YOGA SANGAM PATRA

This is to certify that

M/s GOVERNMENT BBA COLLEGE (SELF FINANCE)

organized Yoga Sangam event to mark the International Day of Yoga on 21st June, 2026.

The event was organized

at KHOKHARA, MANINAGAR and had the participation of 86 people.

It is also to certify that this event was held simultaneously and in harmony with the national event of International Day of Yoga 2026, led by the Hon'ble Prime Minister at Kolkata, West Bengal.

Prataprao Jadhav
Union Minister of State (IC), Ministry of Ayush and
Minister of State, Ministry of Health and Family Welfare

Date: 21st June, 2026
New Delhi

સરકારી બીબીએ કોલેજ(સ્વનિર્ભર)


મણિનગર, અમદાવાદ

૨૧ મી જૂન ૨૦૨૬ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી

સરકારી બીબીએ કોલેજ(સ્વનિર્ભર),મણિનગર, અમદાવાદ ખાતે ૨૧ મી જૂન ૨૦૨૬ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીના ભાગરૂપે “Yoga For Healthy Ageing” થીમ સાથે 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.. જેમાં અત્રેની કોલેજના આચાર્યશ્રી ડો.યોગેશ યાદવ, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ, તથા વિદ્યાર્થીઓ ઉત્સાહભરે ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં કુલ ૮૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડૉ.વીરેન માણેક એ સૂર્ય નમસ્કારનું મહત્વ અને ઉપયોગીતા વિષે રસસભર માહિતી આપી હતી. ત્યારબાદ તેઓએ સૂર્ય નમસ્કાર અને યોગના જુદા જુદા આસનો કરાવ્યા હતા.









Ministry of
Ayush
Government of India



Shri Narendra Modi
Hon'ble Prime Minister



YOGA SANGAM PATRA

This is to certify that

M/s GOVERNMENT BBA COLLEGE (SELF FINANCE)

organized Yoga Sangam event to mark the International Day of Yoga on 21st June, 2026.

The event was organized

at KHOKHARA, MANINAGAR and had the participation of 86 people.

It is also to certify that this event was held simultaneously and in harmony with the national event of International Day of Yoga 2026, led by the Hon'ble Prime Minister at Kolkata, West Bengal.

Prataprao Jadhav
Union Minister of State (IC), Ministry of Ayush and
Minister of State, Ministry of Health and Family Welfare

Date: 21st June, 2026
New Delhi